



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩

કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦



તા.૦૧/૧૦/૨૦૧૮ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૯૧૨/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૯ કેસ કરી, ૪૮ વ્યક્તિઓને ઝડપી, ૧૮૦ લીટર દેશી દારૂ, ૨૪ બોટલ ઈંગ્લીશ દારૂ, ૬૩ ક્વાર્ટર ઈંગ્લીશ દારૂ, ૫ બિયર ટીન, ૧ સ્ફૂટર અને ૧ રીક્ષા કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૫ કેસ કરી ૨૬ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૩૦,૬૨૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૯૧૩/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૭૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧૯ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૧૯૧૪/૧૮

વસ્ત્રાપુર: અલ્કેશકુમાર ગોવિંદલાલ સોની (રહે. દેવદર્શન ફ્લેટ આઇ.ઓ.સી.પેટ્રોલપંપ સામે બોપલ) એ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૯/૯/૧૮ રાતના ૧૧/૧૫ થી તા.૩૦/૯/૧૮ કલાક ૦૦/૩૦ વાગ્યા દરમ્યાન આરોપી નિગમ અરવિંદભાઈ ગાંધી (રહે.શ્રી વિનાયક એપાર્ટમેન્ટ પ્લોટ નં.૫-સી, સેક્ટર-૨૨, દ્વારકા ન્યુ દીલ્લી.તથા બી-૩૩, વિશાલ ટાવર, આનંદનગર, સેટેલાઈટ) એ વસ્ત્રાપુર, માનસી સર્કલની બાજુમા, સેટેલાઈટ પ્લાઝા ખાતે ફ્લેટ વેચવા વિશ્વાસમા લઈ રૂપિયા ફ્લેટ ની કીમત ૫૫ લાખ નક્કી કરી રોકડ રૂપિયા ૧૨ લાખ લઈ અને રૂપિયા ૮ લાખ જુદાજુદા ત્રણ ચેક લઈ પહોંચ લઈ સહી કરાવી બાકીના પૈસા દસ્તાવેજ સમયે લેવાનું કહી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે.આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી ડી.વી.વાલાણી ચલાવે છે.

ગુજરાત યુનિવર્સિટી: જીગીશભાઈ શૈલેષભાઈ વ્યાસ (રહે.ગોપીનાથ સોસાયટી ડ્રાઇવ ઇન રોડ થલતેજ) એ તા.૩૦/૦૯/૧૮ નારોજ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે સને ૨૦૧૪ થી આજદીન સુધીના સમયગાળા દરમ્યાન સેપ્ટ યુનિવર્સિટી ખાતે આરોપી ગીતાંજલી યશવંતરાવ ખાડે (રહે. બ્લોક-એ બીજો માળ પુર્ણિમા એપાર્ટમેન્ટ ઇશ્વરભુવન નવરંગપુરા કોમર્સ ઇ રસ્તા પાસે) એ વિશ્વાસમા લઈ લગ્ન કરી કેનેડા જવાની લાલચ આપી જુદી-જુદી રીતે કુલ રૂપિયા ૫,૧૧,૮૦૩/- લઈ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી ડી.કે.ઠાકોર ચલાવે છે.

ધરફોડ:-

સમાચાર યાદી નં.૧૯૧૫/૧૮

નરોડા: પંકજકુમાર ભીખાભાઈ પટેલ (રહે.વાઇબ્રન્ટ હોમ્સ દેહગામ રિંગ રોડ નરોડા) એ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૮/૦૯/૧૮ કલાક ૭/૩૦ થી તા.૩૦/૦૯/૧૮ સાંજના ૫/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના દરવાજાનું તાળુ તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી સોનાનું મંગળસુત્ર કિંમત રૂપિયા ૬૦,૦૦૦/-, સોનાની બુટી કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- અને રોકડ રૂપિયા ૨,૩૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૩,૨૦,૦૦૦/- મતાની તેમજ સાહેદ વિશાલભાઈ પનારાના મકાનમાંથી સોનાની ચુની, સોનાની કડી અને રોકડ રૂપિયા ૨૫,૦૦૦/- મળી રૂપિયા ૩૪,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એન.કે.ડાભી ચલાવે છે.

વાહન અકસ્માતમાં મૃત્યુ:-

સમાચાર યાદી નં.૧૯૧૬/૧૮

કાલુપુર: ભાવેશભાઈ રમણલાલ પટેલ (ઉ.વ.૪૭) (રહે. મુનલાઈટ એપાર્ટમેન્ટ ભગવતી સર્કલની બાજુમાં મહાવિરનગર હીરાવાડી) એ કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૯/૯/૧૮ સાંજના ૭/૩૦ વાગ્યાના સુમારે ભાવેશભાઈ પટેલના સસરા ચીમનભાઈ ભવાનભાઈ પટેલ (ઉ.વ.૭૦) (રહે. ગામ કંથારીયા તાલુકો-અંકલાવ જીલ્લો આણંદ) કાલુપુર ધી બજાર બી.આર.ટી.એસ.બસ સ્ટેન્ડની બાજુમાં સિંગચણાની દુકાન આગળથી પસાર થઈ રહ્યા હતા ત્યારે લોડીંગ રિક્ષા નંબર જી.જે-૦૧-એચ-૧૬૫૭ ના ચાલકે રિક્ષા પુરઝડપે અને બેદરકારીથી ચલાવી ટક્કર મારતા ગંભીર ઈજાઓ થતા સારવાર માટે શારદાબહેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૩૦/૯/૧૮ કલાક ૦૦/૫૫ વાગે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.એચ.કછોટ ચલાવે છે.

નરોડા: કમલેશભાઈ જયંતિભાઈ શાહ (ઉ.વ.૬૩) (રહે. ચંપાનિવાસ જુની હાઇકોર્ટ સામે ઇંકમટેક્સ નવજીવન રોડ) એ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૩૦/૯/૧૮ બપોરના ૨/૦૦ વાગ્યાના સુમારે કમલેશભાઈ તેમના પત્ની સાથે પોતાની આઈ-૨૦ ગાડીમાં બેસી નરોડા શ્યામ શિખર-૨ રેસીડન્સી સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઓવરટ્રેક કરતા ગાડીનો કાબુ ગુમાવતા ગાડી ઝાડ સાથે અથડાતા કમલેશભાઈના પત્ની અસ્મિતાબહેનને ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.વી.સોલંકી ચલાવે છે.

દાઝી જતા મૃત્યુ:-

સમાચાર યાદી નં.૧૯૧૭/૧૮

રામોલ: ચંદાબહેન રાજેશભાઈ સરોજ (ઉ.વ.૨૦) (રહે. રાજીવનગર ટેકરો રામોલ ગામ) તા.૨૪/૯/૧૮ બપોરના ૨/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પ્રાયમસ ઉપર ચા બનાવતા હતા ત્યારે ભડકો થતા દાઝી ગયા હતા. સારવાર માટે તેમને એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૩૦/૯/૧૮ બપોરના ૨/૪૫ વાગે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે રામોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એ.જે.લાઠીયા ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૧૯૧૮/૧૮

સરદારનગર: અમરેન્દ્રસિંહ રામપ્રતાપસિંહ રાજપુત (ઉ.વ.૪૬) (રહે. દ્વારકાનગર નોબલનગર) એ અગમ્ય કારણસર તા.૨૯/૯/૧૮ રાતના બપોરના ૨/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે સરદારનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી જયેન્દ્રસિંહ લાલસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.